

-: આઅમાલે ખેર :-

જેથી મુમેનીનના ઘરોથી શૈતાન દુર રહે છે.

મુમીનનું ઘર જન્તના બગીચાની મીસીલ છે. તમારા ઘરને જન્તી બગીચો બનાવવા વાસ્તે ચંદ ચીઝો પર ગૌર કરી તે પર અમલ કરવું ઝરૂરી છે.

૧. ઘર માં આયતુલ કુરસી યા કલામુલ્લાહની આયતોની તખ્તી અને પંજતને પાક (અ.સ.) ના મુબારક નામો રાખવા.
૨. એઠા વાસણ, મેલા કપડા અને કચરો જલ્દ અઝ જલ્દ સાફ કરવો, વધારે વકત તક ઘરને ગંદુ રાખવું નહીં.
૩. દરો દીવાર, આંગણુ તેમજ ઘરનું ફરશ પાક રાખવું.
૪. હમ્મામખાનું (અંગોલીયું) અને બૈતુલ ખલા (સંડાસ) ને સાફ અને ચોખા રાખવા અને બરાબર પાની મોહય્યા કરવું.
૫. ફજર ના ફરઝ બાદ તીલાવતે કુરઆનની આદત રાખવી, બલંદ આવાઝથી પઢવું જેથી ઘરના બીજા લોકો સાંભલે અને બરકત હાસીલ કરે.
૬. નાય, સંગીત, નગમા અને ટીવી ની બરાબ સીરીયલોથી અને તેની નાપાકીથી ઘરના માહોલને બચાવવો અને બચ્યાઓ આ શૈતાની આદતો તરફ હોશ ન કરે તેનો ખાસ ખયાલ રાખવો.
૭. શરાબ, પડીકી, તંબાકુ, સીગરેટ જેવી નશીલી અને છાકની ચીઝોથી ઘરને મેહફુઝ રાખવું.
૮. જમતી વકત હાથને ધોવા, જમન બરાબર તેહઝીબથી જમવું, જમનને સાફ કરવું અને રદ ન કરવું, જમી રહ્યા પછી હાથને ધોવા, બચ્યાઓને રાતે હાથ ધોઈને સુવાડવા, ફજર માં દાતન કરવું વગેરા શૈતાનના વસવસાને દુર કરે છે.
૯. નાફેલતની નમાઝો, નિસ્ફીલ્લૈલ અને દુઆઓથી ઘરને બા-બરકત રાખવું. ગાલી-ગલોચ, બદકલામી, ગીબત અને ઈલઝામ જેવા બદઆઅમાલ થી પરહેઝ કરવો.
૧૦. માં-બાવાજી, મરદો, બૈરો અને ફરઝંદોથી નેક અપ્લાકી, મોહબ્બત અને નરમીથી પેશ આવવું, બેવજહ ગુસ્સો કરવો અને કોઈની ઈઝઝતનો ખયાલ ન રાખવો તે અકલને મારી નાખે છે.
૧૧. ઔલેયાઉલ્લાહ પર સલવાત અને દોઆત અને બુરુર્ગોના ફાતેહા મુબારકા પઢવા.
૧૨. સુરતુલ ફાતેહા, સુરતુન્નાસ, સુરતુલફલક અને સુરતુલ ઈખ્લાસ પઢવાની આદત રાખવી ખાસ કરીને રાતે સુતા પહેલા.
૧૩. અહલુલ બૈત (અ.સ.) અને રસુલે અકરમ (સ.અ.વ.વ) પર સલવાત પઢવી.
૧૪. અલ્હમ્દોલીલ્લાહ, અસ્તગફેરુલ્લાહ, માશાઅલ્લાહ, સુબ્હાનલ્લાહ, લા હૌલા વલા કુવ્વતા ઈલ્લા બીલ્લાહ ની તરબીહ જહાં તક બની શકે વહાં તક નૌકે ઝબાન રાખવી.
૧૫. વુઝુ, ગુસુલ, બૈતુલ ખલા અને બૈરો સાથે હમબીસ્તરીના કાનુન ને અમલમાં મુકવા.
૧૬. બદન અને કપડાની ચોખ્ખાઈ, દાઢી-ટોપી, રીદા-મકનો, નખ કાપવા, પેશાબ-મૂંછ-બગલના બાલ લેવા અને બીજી પાકીનો ખયાલ રાખવો. ★